

B.Ed. Semester - 2 (CBCS) Examination**March/April- 2018****ELEMENTS OF ACCOUNT****(SELF STUDY COURSE)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	નીચેના પ્રત્યેક પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો.	(૦૮)
(૧.૧)	ઉપલક્ષ ખાતું એટલે શું ?	
(૧.૨)	ઘસારાની કોઈ એક વ્યાખ્યા આપો.	
(૧.૩)	અનામત એટલે શું ?	
(૧.૪)	હૂંડીની વ્યાખ્યા આપો.	
પ્રશ્ન-૨	નીચેનામાંથી કોઈપણ ચારના જવાબ આપો.	(૧૨)
(૨.૧)	ઘસારાની જોગવાઈના હેતુઓ સ્પષ્ટ કરો.	
(૨.૨)	વેપાર ખાતા અને નફા-નુકશાન ખાતા વચ્ચે તફાવતના ત્રણ મુદ્દા આપો.	
(૨.૩)	વ્યવહારની બેવડી અસરનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો.	
(૨.૪)	એકનોંધી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ વચ્ચે તફાવતના કોઈપણ ત્રણ મુદ્દા આપો.	
(૨.૫)	પ્રણાલિકાગત જાતે લખાતા હિસાબો અને કમ્પ્યુટરથી લખાતા હિસાબો વચ્ચે તફાવતના ત્રણ મુદ્દા આપો.	
પ્રશ્ન-૩	નીચેનામાંથી કોઈપણ ત્રણના જવાબ આપો.	(૧૫)
(૩.૧)	હિસાબી ભૂલોના પ્રકારો સમજાવો.	
(૩.૨)	સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચે તફાવતના પાંચ મુદ્દા આપો.	
(૩.૩)	હૂંડી અને વચનચિઠ્ઠી વચ્ચે તફાવત આપો.	
(૩.૪)	દેશીનામાના કોઈપણ પાંચ લક્ષણો સ્પષ્ટ કરો.	
(૩.૫)	વેપારી સંસ્થાના હિસાબો અને બિનવેપારી સંસ્થાના હિસાબો વચ્ચે તફાવતના પાંચ મુદ્દા આપો.	

ENGLISH VERSION

Que-1	Answer the following in brief.	(08)
(1.1)	What is suspense account ?	
(1.2)	Give one definition of depreciation.	
(1.3)	What is reserve ?	
(1.4)	Give definition of Bill of Exchange.	
Que-2	Answer any four from following.	(12)
(2.1)	Explain objective of provision for depreciation.	
(2.2)	Give three difference between trading account and profit and loss Account.	
(2.3)	Explain Dual Aspect Concept with example.	
(2.4)	Give any three difference between single entry System and Double entry system.	
(2.5)	Give any three difference between conventional Accounting and Computer Accounting Method.	
Que-3	Answer any three from following.	(15)
(3.1)	Explain types of errors.	
(3.2)	Give fire difference between general reserve and Provisions.	
(3.3)	Give difference between Bill of exchange and Promissory Note.	
(3.4)	Explain any fire characteristics of Deshi Nama System.	
(3.5)	Give any five difference between the accounts of Trading and non trading concerns.	
